
રોકડીયા પાકો

§§

૧. કપાસ

(સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, ન. કૃ. યુ., સુરત)

જમીન અને જમીનની તૈયારી

પિયતની સગવડ હોય તો ઉનાળામા શાણ કે ઇકકડનો લીલો પડવાશ કરેલ હોય તો જમીનમા લેળવી દેવો. ઉનાળામાં બે થી ત્રણ વર્ષના અંતરે ટ્રેકટરથી ઊંડી ખેડ કરવાથી બહુવર્ષાયુ જીવાતના ક્રોશેટા-ઘ્યુપાનું પ્રમાણ ઘટાડી શકાય છે. ઉનાળા કે ચોમાસુ ઋતુની શરૂઆત થાય તે પહેલાં જમીનને હળ કે ટ્રેકટરથી ખેડવી, પંચીયુ કે કરબથી ખેડી જમીનને તૈયાર કરવી. આગલાં પાકના અવશેષો શ્રેડર અથવા રોટાવેટરથી જમીનમાં લેળવવાં, ચાસમાં ૧૫ સે.મી. ઊંડાઈ સુધી સબસોઇલીંગ કરવાથી લેજ સંગ્રહ કરી શકાય છે.

જાતની પસંદગી

સેન્ટ્રિય એતીમાં દેશી કપાસ અથવા જે જાતોમાં પોષક તત્ત્વોની જરૂરિયાત ઓછી હોય અને રોગ-જીવાત સામે પ્રતિકારક હોય તેવી જાત પસંદ કરવી.

| સુધારેલી જાતો | દેશી કપાસની સંકર જાતો | કપાસની સંકર જાતો |
|----------------|--------------------------|--------------------|
| ગુજરાત કપાસ-૧૦ | ગુજરાત કપાસ દેશી સંકર-૭ | ગુજરાત સંકર કપાસ-૪ |
| ગુજરાત કપાસ-૧૬ | ગુજરાત કપાસ દેશી સંકર-૮ | ગુજરાત સંકર કપાસ-૫ |
| ગુજરાત કપાસ-૧૮ | ગુજરાત કપાસ દેશી સંકર-૧૧ | ગુજરાત સંકર કપાસ-૮ |
| ગુજરાત કપાસ-૨૧ | ગુજરાત સંકર કપાસ-૧૦ | |
| ગુજરાત કપાસ-૨૩ | ગુજરાત સંકર કપાસ-૧૨ | |

વાવેતર

વાવણી લાયક વરસાદ થયેથી જૂનના બીજા અઠવાડીયાથી જુલાઈના બીજા અઠવાડીયા સુધીમાં સામાન્ય રીતે વાવેતર કરી શકાય. જ્યાં પિયતની સગવડ હોય ત્યાં મે માસના છેલ્લાંથી જૂન માસના પ્રથમ અઠવાડીયામાં આગોત્ત્રી વાવેતર કરી શકાય છે. જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોય અને જમીનમાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન હોય તેવી જમીનમાં નીકપાળા બનાવી પાળા ઉપર કપાસના બીજની વાવણી કરવી.

વાવેતર અંતર

કપાસના વાવેતરમાં જ્યાં પિયતની સગવડ હોય ત્યાં બે ચાસ વચ્ચે ૧૨૦ સે.મી. અને ચાસમાં બે છોડ વચ્ચે ૪૫ સે.મી. જેટલું અંતર રાખવું. જ્યારે બિનપિયત વિસ્તારમાં બે ચાસ વચ્ચે ૬૦ સે.મી. અને ચાસમાં બે છોડ વચ્ચે ૩૦ સે.મી.નું અંતર રોગ માલૂમ પડયું છે.

બિયારણનો દર

૩.૫ થી ૪.૦ કિ.ગ્રા./ હેક્ટર રાખી જમીનમાં લેજને ધ્યાનમાં રાખી ૪-૬ સે.મી.ની ઊંડાઈએ વાવણી કરવી હિતાવહ છે.

બીજ માવજત

જમીનમા નાઇટ્રોજનના સ્થિરીકરણ માટે ૧ કિ.ગ્રા. બિયારણ દીઠ ૩૦ ગ્રામ એઝોટોબેક્ટર તથા ફોસ્ફેટ કલ્યાનનો પટ આપવો જોઈએ.

પારવણી અને ખાતાં પુરવા

બે કે વધુ છોડ હોય ત્યાં એક છોડ રાખી પારવણી કરવી, તથા જ્યાં બીજ ઉગેલ ન હોય ત્યાં ખાલાં જલ્દીથી પૂરવા. શક્ય હોય તો ખાલા પૂરવા માટે અગાઉથી પોલીથીન બેગમાં ઉછેરેલ છોડ વાપરી શકાય.

ખાતર

પિયત વિસ્તાર માટે હેક્ટર દીઠ ૨૦ ટન તથા બિન પિયત વિસ્તાર માટે હેક્ટર દીઠ ૧૦ ટન છાણીયું ખાતર અથવા કંપોસ્ટ અથવા ૨ ટન દિવેલીનો ખોળ નાંખવો. હેક્ટર દીઠ ૨ કિ.ગ્રા. એઝોટોબેક્ટર ૧૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતરમાં એનરીચ કરી જમીનમાં નાંખવું.

નિંદામણ અને આંતરખેડ

કપાસનું વધુ ઉત્પાદન મેળવવા માટે પાકની શરૂઆતની વૃદ્ધિના ૫૦ થી ૬૦ દિવસ સુધી પાકને નીંદણથી મુક્ત રાખવો ખુબ જ જરૂરી છે, શરૂઆતની અવસ્થાએ બે થી ત્રણ નિંદામણ અને આંતરખેડ કરવી અથવા જરૂરિયાત મુજબ ગાળાફેર કરી આંતરખેડ કરવી જોઈએ. ૪૦ દિવસે આંતરખેડ કર્યા બાદ પાણી ચઢાવવા.

પિયત

વરસાદની ઋતુમાં જમીનમાં ભેજની ખેચ પડે ત્યારે પિયતની સગવડ હોય તો જરૂરિયાત મુજબ પિયત આપવું જોઈએ. છેલ્લા વરસાદ પછી ૨૦ થી ૨૫ દિવસે પ્રથમ પિયત આપવું જોઈએ. વરસાદ પછી ૨૦ થી ૨૫ દિવસના અંતરે કપાસના પાકને ૨ થી ૩ પિયતની જરૂર પડે છે. એકાંતરે ચાસમાં પિયત આપવાથી પાણીનો બચાવ થાય છે. કપાસમાં ટપક પદ્ધતિથી પાણી આપવાથી પિયતમાં ૪૦ ટકા પાણીનો બચાવ થાય છે તેમજ નીંદણો ઓછા થાય છે. સેન્ટ્રિય કે પ્લાસ્ટિકના આવરણથી પિયત પાણીનો બચાવ અને નીંદણ નિયંત્રણ કરી શકાય છે.

આંતરપાક

કપાસનું વાવેતર પહોળા પાટલે કરવામાં આવતું હોવાથી કપાસની બે હાર વચ્ચે સોયાબીન, મગ, અડદ જેવા આંતરપાક લેવાથી વધુ નશો મળે છે.

જીવાત નિયંત્રણ

કપાસની જીવાતોના સંકલિત નિયંત્રણ વ્યવસ્થા માટે નીચે પ્રમાણેના પગલાંઓ લેવાંની ભલામણ કરવામાં આવે છે.

૧. શરૂઆતમાં કાબરી ઈયળથી થતાં નુકશાનને અટકાવવા માટે નુકશાન પામેલ ફૂંઝને ઈયળ સાથે હાથથી તોડી નાશ કરવો.
૨. પાક ઉત્ત્યાં પછી એક અઠવાડીએ જીડિવાની ઈયળોના તથા લશકરી ઈયળની જાણકારી માટે હેક્ટરે ૮ રોકના ૫ ફેરોમોન ટ્રેપ મુકવાં અને તેમાંની ટ્યુર્સ દર ૧૫ દિવસે અચૂક બદલવી અને ટ્રેપમાં પકડાયેલા ફૂંઝાનો રોજરોજ નાશ કરવો.
૩. કપાસની શરૂઆતની અવસ્થાએ યૂસીયા જીવાતો માટે કાયસોપાના ઈંડા/ પ્રથમ અવસ્થાની ઈયળો હેક્ટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં ત્રણ વખત છોડવા. જૈવિક ફૂગ વર્ટીસીલીયમ લેકાની ૧૦ ગ્રામ પ્રતિ લીટર પાણીમાં લેજવી અઠવાડીયાનાં અંતરે છંટકાવ કરવા.
૪. જીડિવાની ઈયળોના ઉપદ્રવને ધ્યાને લઈ છંડાના પરજીવી ટ્રાઇકોગામા ભમરી હેક્ટરે ૧.૫ લાખની સંખ્યામાં ચાર વખત છોડવી.
૫. લીંબોળીના મીંજમાથી બનાવેલ ૫% નાવણનો છંટકાવ કરવો. તે માટે ૧૦ લી. પાણીમાં ૫૦ મી.લી. ઉમેરી છંટકાવ કરવો.
૬. જ્યારે લીલી ઈયળ નાની અવસ્થામાં હોય ત્યારે એચ.એન.પી.વી. હેક્ટરે ૪૫૦ ઈયળ ઓંક (એલ.ઈ.) પ્રમાણે છંટકાવ કરવો. જીવાણુયુક્ત જંતુનાશક દવા, બીટી પાવડર હેક્ટરદીઠ ૧.૫ થી ૨ કિ.ગ્રા.નો પાણીમાં લેજવી છંટકાવ કરવો.

-
૭. નુકશાન પામેલ ફૂલ, કળી, ઝૂખ તેમજ લશકરી ઈયળના ઈંડા અને ઈયળનો સમૂહ કપાસના પાકમાંથી હાથથી વીણી નાશ કરવો.
 ૮. કપાસની ૧૦ હાર પછી મકાઈ/ જુવારની ૧ હાર વાવવાથી પરલક્ષી અને પરજીવીઓનું સંરક્ષણ કરી શકાય છે તથા કપાસને ફરતે અને વચ્ચે ગલગોટા અને દિવેલાં વાવવાથી અનુકૂમે લીલી ઈયળ તથા લશકરી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે અને પરલક્ષી તેમજ પરજીવીઓની સંખ્યા જાળવી શકાય છે.
 ૯. ગુલાબી ઈયળની મોજણી માટે હેક્ટર ઈંઠ ૫ ફેરોમોન ટ્રેપ લગાડવા તેમજ ફૂદાની સંખ્યા વધુ પકડાતી જણાય તો હેક્ટર ઈંઠ ૪૦ ટ્રેપ મૂડી ફૂદાનો સામુહિક રીતે નિકલ કરવો.
 ૧૦. સેન્ટ્રિય ઐતીમાં લસણ, ધતુરો, નફફટીયા જેવા વનસ્પતિજન્ય તેમજ ગૌમુત્ર જેવાં પેદાશોની કિટક નિયંત્રણ તરીકે વપરાશ કરી શકાય.

રોગ નિયંત્રણ

દિવેલીનો ખોળ હેક્ટરે ૫૦૦ કિ.ગ્રા. વાવવાથી પહેલાં ચાસમાં આપવાથી સૂકારાની અસર ઓછી જોવા મળે છે.

કપાસની વીણી

પ્રથમ વીણી ૪૦ થી ૫૦% જીડવા ખુલ્લા થઈ શકે ત્યારે જ કરવી. બીટી કપાસમાં જીડવા છોડ પર એક સાથે ઘણી સંખ્યામાં બેસવાથી ત્રણ વીણીમાં લગભગ બધા જ જીડવા ફાટીને પરિપક્વ થતાં હોય છે. વીણી કરતી વખતે કપાસની સાથે કીટી, સૂકાં પાન અને અન્ય કચરો કે જીવાત ન આવે અથવા ઓછા આવે તેની ખાસ કાળજી રાખવી. કપાસની વીણી વખતે અંકળ કે ધુમ્મસ હોય તો વીણી કરેલ કપાસને સૂર્યના તાપમાં સૂકવીને સંગ્રહ કરવો જોઈએ.

૨. શેરડી

(સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર, ન. કૃ. યુ., નવસારી)

જમીન અને પૂર્વખેડ

મધ્યમ કાળી, ગોરાડું અને ઉંડી જમીન માફક આવે છે. શેરડીનું ભારે કાળી જમીનમાં વાવેતર કરવું હોય તો નિતારની સારી વ્યવસ્થા કરી માફકસર પિયત કરવામાં આવે તો આવી જમીનમાં પણ સફળતાપૂર્વક શેરડીનો પાક લઈ શકાય છે. ટ્રેકટર અથવા બળદારી ચાલતાં લોખંડી હળથી ૨૦ થી ૨૫ સે.મી. ઉંડી ખેડ કરી માટીના ફેફા ભાંગી નાખવા અને જમીન સમતલ/ભરભરી બનાવવી.

સુધારેલી જાતો

શેરડીની જાતોને તેના પાકવાના દિવસોના આધારે વહેલી પાકતી (૧૦ થી ૧૨ માસ), મધ્યમ મોડી પાકતી (૧૨ થી ૧૪ માસ) અને મોડી પાકતી (૧૪ થી ૧૬ માસ) એમ ત્રણ જીથોમાં વહેંચવામાં આવે છે.

વહેલી પાકતી જાતો: ગુજરાત શેરડી-૩ (કોએન ૮૫૧૩૨), ગુજરાત શેરડી-૪ (કોએન ૦૩૧૩૧), ગુજરાત શેરડી-૫ (કોએન ૦૫૦૭૧), જુઝનાસ-૮ (કોએન ૦૭૦૭૨), કોસી. કે. ૧૧ અને કો ૮૫૦૩૨

મધ્યમ મોડી પાકતી જાતો: ગુજરાત શેરડી-૧ (કોએન ૮૧૧૩૨), ગુજરાત શેરડી-૨ (કોએન ૮૫૧૩૪), ગુજરાત શેરડી-૬ (કોએન ૦૫૦૭૨), ગુજરાત નવસારી શેરડી-૭ (કોએન ૦૪૧૩૧) અને કોએમ ૦૨૬૫.

મોડી પાકતી જાતો: કો ૯૨૧૭૫ અને કો ૯૩૦૪

રોપણીનો સમય

શેરડીની રોપણી ઓક્ટોબર-નવેમ્બર તેમજ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ દરમિયાન કરવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે.

બીજ પસંદગી માવજત અને દર

શેરડીનું તંકુરસ્ત બિયારણ ૧૦ માસના રોપાણ પાકમાંથી પસંદ કરી સાંઠાની ઉપરનો ૨/૩ ભાગ રોપવા માટે ઉપયોગમાં લેવો. બાંડી (ચમરી) સાથે ટુકડા રોપવા નહીં. શેરડીના ટુકડાને દ્રાયકોડર્મા અને એસીટોબેક્ટર બંને ૧૦ મી.લી./લીટર મુજબ મિશ્ર કેલેલ દ્રાવણમાં ૧૦ મિનિટ બોળી રોપણી કરવી. આ ઉપરાંત ફોસ્કરસ સોલ્યુબીલાઇઝીંગ બેક્ટેરીયા અને પોટાશ મોબીલાઇઝીંગ બેક્ટેરીયા ૨.૫ મી.લી./લીટર દ્રાવણની માવજત આપી રોપણી કરવી. બિયારણનો દર પ્રતિ હેક્ટરે બે આંખવાળા ૫૦,૦૦૦ ટુકડા રોપવાની ભલામણ છે. હેક્ટરે ૬ થી ૭ ટન બિયારણ પૂરતું છે.

રોપણી અંતર

શેરડીની રોપણી ૮૦ સે.મી. થી ૧૦૫ સે.મી.ના અંતરે કરવામાં આવે છે. શેરડીનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે બે હાર વચ્ચે ૮૦ સે.મી.નાં અંતરે રોપણી કરવાની ભલામણ છે. શેરડી રોપણીની જોડીયા હાર પદ્ધતીમાં બે હાર વચ્ચે ૨૫ થી ૩૦ સે.મી. અને બે જોડીયા હાર વચ્ચે ૧૨૦ સે.મી.ના અંતરે રોપણી કરવી. દક્ષિણ ગુજરાતમાં બે જોડીયા ચાસ વચ્ચે ૫૦ સે.મી. અને બે જોડીયા હાર વચ્ચે ૧૨૦ સે.મી.ના અંતરે રોપણાથી શેરડીનું વધુ ઉત્પાદન મેળવી શકાય. ૧૨૦ સે.મી.ના જોડકા હાર પદ્ધતિથી વાવેતર માટે નીકની બંને બાજુઓ એકાંતરે ટુકડાં ગોઠવવા.

ખાતરનું પ્રમાણ

- સેન્ટ્રિય ખાતર:** શેરડીનું વધુ ઉત્પાદન અને ખાંડનો ઉતારો મેળવવા માટે હેક્ટર દીઠ ૨૫ ટન છાણીયું ખાતર અથવા

દીવેલીનો ખોળ કરપ કિ.ગ્રા. અથવા પ્રેસમડ ૧૧ ટન આપવું અથવા શાણનો લીલો પડવાશ કરવો.

- **જૈવિક ખાતર:** શેરડીની રોપણી બાદ ૩૦ દિવસે એસીટોબેક્ટર અને ૫૦ દિવસે એઝેટોબેક્ટર દરેક વખતે હેક્ટરે ૨.૫ લીટર આપવું અથવા શેરડીની રોપણી બાદ ૩૦ અને ૫૦ દિવસે દરેક વખતે ર કિ.ગ્રા. એઝેટોબેક્ટર કલ્યાર આપવાથી રપ થી ૫૦% નાઈટ્રોજનનો બચાવ થઈ શકે છે. એસીટોબેક્ટર અને એઝેટોબેક્ટર કલ્યારને ૩૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતર સાથે લેળવી, થોડા પાણીનો છંટકાવ કરી, એક રત રાખ્યા બાદ, ચાસની બાજુમાં ઓરીને આપવું એઝેટોબેક્ટર ખાતર વાપરવાથી રપ થી ૫૦% નાઈટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરની બચાત થાય છે. અને શેરડીનું ઉત્પાદન ૧૫-૨૦% ટન/હેક્ટર વધે છે. આ ઉપરાંત પાણા ચઢાવતી વખતે ૦.૫% એસીટોબેક્ટર જૈવિક ખાતર આપવું જે શેરડીના સાઠામાં રહીને હવામાનો નાઈટ્રોજન સ્થિર કરે છે. ફૂટ અને સાંઠાના વિકાસ અવસ્થાએ ૨% ગૌમુત્ર અને છાશનો છંટકાવ કરવો.
- **દરિયાઈ લીલ (સીવીડ સેપ):** ૭.૫% ગેસીલેસીયા સેપનો છંટકાવ કરવાથી શેરડીના સાંઠા તથા ખાંડ ઉત્પાદનમાં સુધારો થાય છે.
- **લીલો પડવાશ અને પાક ફેરબદલી:** જમીનમાં જૈવિક પ્રક્રિયા વધે અને રોગકારકોનો નાશ થાય તે માટે શાણ કે ઈક્કડનો લીલો પડવાશ કરવો. શેરડીના રોગકારકો લાંબા સમય સુધી જમીનમાં સજીવ રહે છે જેથી લાંબાગાળાના પાકની ફેરબદલી કરવી જેમ કે ડાંગરના બે પાક (ઉનાળું/ચોમાસુ) સાથે કરી ફરી શેરડી કરવી.

અંતરપાક

શેરડીમાં રોપણી બાદ ર થી ત માસ સુધી પાકની વૃધ્ઘિ ધીમી રહે છે. તેમજ શેરડીનાં પાકનું પહોળા અંતરે વાવેતર થાય છે અને શેરડી લાંબાગાળાનો પાક હોઇ, ટુંકગાળાના અંતરપાક લેવામાં આવે તો શેરડીના પાકને માટી અસર થયા વગર વધારાની આવક મેળવી શકાય છે. શેરડીની રોપણી ઓકટોબર થી ડિસેમ્બર દરમિયાન કરવામાં આવે ત્યારે શેરડીની બે હાર વચ્ચે ઠુંગણી અથવા લસણ અથવા ઘઉંની બે-ત્રણ હાર કરવાની ભલામણ છે. મધ્ય ગુજરાતમાં શેરડીની રોપણી જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવે ત્યારે ઉભડી મગફળી અથવા મગની એક હાર લેવાની સલાહ છે. શેરડીમાં અંતરપાક તરીકે ચણાં, ઠુંગણી, પાપડી (નવસારી પાપડી સિલેક્શન-૧), લસણનું વાવેતર આંશિક રીતે વધુ પોષણક્ષમ છે. આમ છતાં એઝ્યુનિટ્ મિટ્રો એટીની અનુકૂળતા મુજબ અન્ય અંતરપાકો પણ લઈ શકે છે. જ્યાં ચણાંનો અંતરપાક લેવાનો હોય ત્યાં શેરડીની વાવણી બાદ ત્રણ થી ચાર દિવસે ચણાંની વાવણી કરવી.

અંતરપેડ, નિંદામણ અને પાળા ચઢાવવા

શેરડીનો પાક ૪ થી ૫ મહીનાનો થાય ત્યાં સુધી અવશ્યપણે નીદણમુક્ત રાખવો. ર થી ત વખત હાથથી નિંદામણ કરવું અને દરેક નિંદામણ પહેલાં અંતરપેડ કરવી. શેરડીમાં ૬૦ અને ૧૫૦ દિવસે એમ બે વખત પાળા ચઢાવવા જોઈએ. ૬૦ દિવસે હળવા પાળા ચઢાવવા, જ્યારે ૧૫૦ દિવસે છેવટના લારે કદના પાળા ચઢાવવાથી શેરડીમાં વધારાના પિલાનું અને નીદણનું નિયંત્રણ થાય તેમજ ખાતર જમીનમાં લણે છે. થડમાં માટી પડવાથી શેરડી મોટી થતાં ઢળી પડતી નથી. વળી ચોમાસામાં વધારાના પાણીના નિતાર માટે પણ ઉપયોગી થઈ શકે. જેથી શેરડીના પાકમાં પાળા ચઢાવવા ફાયદાકરક છે.

પિયત

શેરડી લાંબાગાળાનો પાક છે આથી જમીન તેમજ હવામાન પ્રમાણે પિયતની જરૂરિયાત જુદી-જુદી રહે છે. કાળી જમીનમાં પાકને ૧૪ પિયત આપવાની લલામણ છે. આ પિયત શિયાળામાં રર થી ૨૫ દિવસે અને ઉનાળામાં ૧૫ થી ૨૦ દિવસના ગાળે આપવા. જ્યારે પ્રથમ લામ પાકને ૧૩ પિયત શિયાળામાં ૨૨ થી ૨૫ દિવસના ગાળે અને ઉનાળામાં ૧૫ થી ૨૦ દિવસના ગાળે આપવા. મધ્ય ગુજરાતની ગોરાડુ જમીનમાં હેક્ટરે ૧૦ ટન શેરડીની પાતરી આવરણ (મલ્ય) તરીકે પાથરી ૧૬-૧૭ પિયત ફેબ્રુઆરી સુધી ૧૮-૨૦ દિવસના ગાળે અને માર્યા-એપ્રિલ દરમિયાન ૮-૧૦ દિવસના ગાળે આપવી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં શેરડીની પાતરીનો આવરણ (મલ્ય) તરીકે ઉપયોગ કરી (૫-૧૦ ટન/હેક્ટર) ૩૪ પિયત આપવા.

ઉનાળા દરમ્યાન ૮-૧૦ દિવસનાં ગામે અને શિથાળા દરમ્યાન ૧૫-૧૭ દિવસના ગામે પિયત આપવા. કાઢી જમીનમાં શેરડીના પાકને એકાંતરે નીકપાળામાં પિયત આપવાની સાથે શેરડીની પાતરીનું હેકટરે ૧૦ ટન પ્રમાણે જમીન પર આવરણ કરવાથી ૩૬% જેટલાં પિયતના પાણીનો બચાવ થઈ શકે છે. જોડીયા હાર પદ્ધતિ અપનાવી ટપક પદ્ધતિ દ્વારા પિયત કરવું, શેરડીના પાકમાં ટપક પદ્ધતિ અપનાવાથી ૪૦-૫૦% પાણીનો બચાવ થાય છે અને ખાતરની કાર્યક્ષમતા વધે છે.

અન્ય ઘેરી કાર્યો

શેરડીનો વધુ ઉતાર લેવા તેમજ ખાંડની ટકાવારી વધારવા રોપણી બાદ ક, અને ૮ મહિને એમ ત્રણ વખત ૨૫% પણો (શેરડીના સાંથે ઉપરના કુલ પણોના નીચેથી ચોથા ભાગના પણો કે જે સૂકાયેલાં હોય છે) કાઢી ઘેતરમાં જ આવરણ તરીકે ઉપયોગ કરવો. શેરડીના પાન કાઢી નાખવાથી લીંગડાવાળી જીવાત, ચીકટો વગેરે જીવાતોનું તેના કુદરતી દુશ્મનો દ્વારા અસરકારક નિયંત્રણ થઈ શકે છે. ઘેતરમાં શેરડીની પાતરી ભાગવાની સલાહ આપવામાં આવતી નથી. શક્ય હોય તો શેરડીની પાતરીને જમીનમાં લેજવવી.

શૈક્ષિક રોગ-જીવાત વ્યવસ્થાપન

- ઉનાળામાં ઉંડી ખેડ કરી જમીનને તપાવવી.
- જમીનની જૈવિક પ્રક્રિયાઓ વધે તે માટે લીલો પડવાશ કરવો.
- રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
- તંદુરસ્ત બીજની પસંદગી કરવી અને ગરમ પાણી કે વરાળની બીજ માવજત આપવી.
- રોગગ્રસ્ત શેરડીની કાપણી જલ્દી કરવી.
- દ્રાઇકોગ્રામા ચીલોનીસ અથવા દ્રાઇકોગ્રામા જીયોનીકામ ભમરી હેકટરે ૧ થી ૧.૫ લાખ પ્રમાણે ૫-૬ વાર સવારે/ સાંજે છોડવાથી શેરડીના વેધકો નિયંત્રણ કરી શકાય છે.
- યૂસિયા જીવાતોના ભૌતિક નિયંત્રણ માટે સ્ટીકી ટ્રેપ ૧૦ થી ૧૨ નો ઉપયોગ કરવો.
- તડતડિયા અને સફેદ માઝીના નિયંત્રણ માટે લીલોનીમાંથી બનાવેલ ૫% દ્રાવણ (૫૦૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં) નો છંટકાવ કરવો.
- ઘેતરમાં અમૃક અંતરે પિંજરાઓ ગોઠવી ઉંદરો એકઠાં કરી નાશ કરવો.

કૃમિ નિયંત્રણના પગલા:

- પાકની ફેરબદલી કરવાથી ગંઠવા કૃમિનો ઉપદ્રવ ઘટાડી, ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.
- ઉનાળામાં ટેકટરથી ઉંડી ખેડ કરવી, જમીન તપે બીજા વષે કૃમિનો ઉપદ્રવ ઘટે.
- ઘેતરમાં ગલગોટાનો પિંજર પાક તેમજ શણનો લીલો પડવાશ કરવો.
- સેન્ટ્રિય ખાતરો, છાણીયું ખાતર, પ્રેસમાડ ૧૦ થી ૧૫ ટન/ હેકટર, દિવેલીનો ખોળ, લીમડાનો ખોળ, રાયડાનો ખોળ અથવા મરધાનું ખાતર ૧ થી ૩ ટન/ હેકટર જમીનમાં આપવું.

જીવાત નિયંત્રણ માટે સમયસર પાક સંરક્ષણના પગલાં અપનાવવા.

| અ. નૂ. | ઉપલબ્ધ તાંત્રિકતા | તારણો |
|-----------|---|---|
| ૧. | બાબુ પરજીવી એપીરીકેનીયા મેલાનોલ્યુક સવારના સમયે પાયરીલાના ઉપદ્રવવાળા એતરમાં વચ્ચે જ્યાં જે પાન પર પાયરીલાના બચ્ચાં તથા પુસ્ત જોવા મળે તે પાન પર એપીરીકેનીયાના ઠંડાઓના સમૃદ્ધ અથવા કોશેરો બહારની બાજુ રહે તે રીતે સેપલ કરવા. સામાન્ય રીતે એક ફેફર વિસ્તારમાં એક લાખ ઠંડા (ઠંડાના રૂપો સમુહ) અને બે હજાર કોશેરાઓ ચોટાડવા જોઈએ. | <ul style="list-style-type: none"> શેરડીની પાયરીલા જીવાતનું સફળતાપૂર્વક નિયંત્રણ તેના બાબુ પરજીવી એપીરીકેનીયા મેલાનોલ્યુકથી થાચ છે. શેરડીના એતરમાં પાતરી બાળતાં પહેલાં પીળા કે સૂક્ષ્મ પાન પર જોવા મળતો એપીરીકેનીયાના કોશેરાઓ કે ઠંડાના સમૃદ્ધો એકથા કરી નવા રોપણ પાકમાં છોડવા. આ કામગીરીને અગ્રિમત્તા આપી અમલમાં મૂકવાથી પાયરીલાનો ઉપદ્રવ થાય ત્યારે ફરીથી એપીરીકેનીયા છોડવાની જરૂરિયાત રહેતી નથી. |
| ૨. | શેરડીના વેધકોના ઠંડાના પરજીવી દ્વારાકોગ્રામા ચીલોનીસનો દક્ષિણ ગુજરાતમાં કેટલોક સુગર ફેફરીઓનો તેમજ જીવિક પ્રયોગશાળાઓમાં આ પરોપજીવીઓનો મોટા પાચ પર ઉછેર કરે છે, વેધકોના જીવિક નિયંત્રણ માટે એક ફેફર વિસ્તાર માટે દર ૧૫ દિવસના અંતરે બે દ્વારાકોક શેરડીના પાકમાં વેધકોના ઉપદ્રવને ધ્યાનમાં લઈને ક થી તુ વખત ઉપદ્રવિત એતરમાં સવારના સમયે શેરડીના ટોચના પાન પર સેપલારની મદદથી સેપલ કરી દેવામાં આવે છે. | શેરડીના ટોચવેઘક, ઇંખવેઘક, સાંઠાના વેઘક, પીરાઈ વેઘક અને આંતરગાંઠ વેધકોનું અસરકારક સંકલિત નિયંત્રણ કરી શકાય છે. આ રીતે દ્વારાકોક એફ્લોટોના મિત્ર તરીકે અવિરત કામગીરી બજાવે છે. |
| ૩. | શેરડીની સફેદ માખીનાં જીવિક નિયંત્રણ માટે એનકાર્સિયા ઇસાડી તેમજ એનકાર્સિયા મેકોપ્ટેરા નામના પરજીવીઓ ઉછેરી શકાય છે. એક ફેફર વિસ્તાર માટે પાંજરાની બે બાજુઓ ઝોડું મેશની જાળી લગાવેલી ૧૦ થી ૨૦ પાંજરાને જમીનથી બે થી ત્રણ ફૂટની ઊચાઈએ સૂર્યનો સીધો તાપ ન લાગે તે રીતે લટકાવેલ પાંજરામાં ૧૫ થી ૨૦ દિવસે કોશેરાવાળા પાન બદલતાં રહેંનું. | શેરડીની સફેદમાખીનાં ચાંત્રિક તેમજ જીવિક પદ્ધતિથી અસરકારક નિયંત્રણ કરી શકાય છે. શેરડીના એતરમાં સફેદ માખીના કોશેરાઓમાં ગોળ કારાં જોવા મળે તે સફેદ માખીના પરજીવીની બાજરી સૂચયે છે વધારે પડતાં પાણીના નિકાલ માટે યોગ્ય નિતાર વ્યવસ્થા કરવી. |
| ૪. | શેરડીના રોપણી બાદ ક, ચ અને દ મહિને સાંઠાના નીચેના ભાગની સૂક્ષ્મ પાતરી દ્વારા કરવી. | શેરડીના સાંઠાની જીવાતો (ચીકટો અને લીગડાવાળી જીવાત) નું નિયંત્રણ થાય છે અને શેરડીની ગુણવત્તા સુધરે છે. |
| ૫. | શેરડીના વુલી એકિડને ખાતાં પરજીવી, પરબદ્ધી કિટકો ચેકી માઇકોમસ, ડાયક્ષા, કાયસોપલ્સ અને સિરફીડ ફલાય અગત્યાન અને અસરકારક પરબદ્ધીઓ છે. | શેરડીના પાકમાં વલાયટ વુલી એકિડનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. |
| ૬. | શેરડીના એક ફેફર વિસ્તાર માટે ક ટન જૂના પ્રેસમકડમાં દ્વારાકોડમાં કલ્યારનું સંવર્ધન કરી રોપણી સમયે ચાસમા આપવું. | શેરડીના રોગો સુકરાનો અને રાતડાની કુગા જમીનમાં હોવાથી તે કુગનો દ્વારાકોડમાં વીરીકી નાશ કરે છે અને રોગનું પ્રમાણ ઘટે છે. |
| ૭. | શેરડીના પાક ફેરબદ્દલીમાં લીલા પડવાશ સાથે ડાંગરના બે પાક લેવાની પદ્ધતિ અપનાવવી. | શેરડીના સૂકરાનું ની કુગા ફ્લુઝેરીયમ મોનીલીશેપી બે વરસ સુધી જમીનમાં જીવત રહે છે. તેથી તેનું નિયંત્રણ મળે છે. |

કાપણી

શેરડી પરિપક્વ થયે સમયસર કાપણી કરવી. અપરિપક્વ તથા વધુ પરિપક્વ શેરડીમાં સુકોઝનું પ્રમાણ ઘટે છે. સામાન્ય રીતે આખા એતરમાં પાક પીળો દેખાય, આંખો ઉપસી આવેલી દેખાય, સાંઠા ઉપર ટકોર મારતાં ધાતુ જેવો રથકાર સંભળાય, બ્રિક્સનો આંક ૧૮ કે તેથી વધુ જણાય ત્યારે કાપણી કરવી.

